https://archive.org/details/bk1427/page/n0/mode/1up

2022-06 -Uma Darpan (1427)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

અંક-૨૯૬
કુલ પેજ-૩૬
આજીવન લવાજમ રૂા. ૨૦૦૦
છૂટક કિંમત રૂા. ૨૦

જુન-૨૦૨૨

ઉમા દર્પણ

માનદ્ તંત્રી-રતિલાલ પટેલ

બે વર્ષ પછી કચ્છમાં અખાત્રીજે સમૂહલગ્નના ઢોલ ઢબુકયા

વાંઢાયમાં ઉમાપતિ મહાદેવ મંદિરના દશાબ્દી નિમિત્તે મેડીકલ કેમ્પ યોજાયો



realpatidar.com

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં નારાયણજી બાપાની જન્મજયંતિ ઉજવાઇ

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1427/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 4.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1427/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:14:08 +05'30'

અંક-૨૯૬
કુલ પેજ-૩૬
આજીવન લવાજમ રૂા. ૨૦૦૦
છૂટક કિંમત રૂા. ૨૦

જુન-૨૦૨૨

ઉમા દર્પણ

માનદ્ તંત્રી-રતિલાલ પટેલ

બે વર્ષ પછી કચ્છમાં અખાત્રીજે સમૂહલગ્નના ઢોલ ઢબુક્યા

વાંઢાયમાં ઉમાપતિ મહાદેવ મંદિરના દશાબ્દી નિમિત્તે મેડીકલ કેમ્પ યોજાયો

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં નારાયણજી બાપાની જન્મજયંતિ ઉજવાઇ

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1427/page/n3/mode/1up

Message to community members - about Satpanth Sadhus visit to Sanatani Temples of Vandhay, Sanskar Dham, Khetabapa etc.

realpatidar.com

સનાતની સમાજજનો જોગ સંદેશ

આપણી માતૃ સમાજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જ્ઞાતિમાં સંપૂર્ણ સનાતન ધર્મની પુનઃ સંસ્થાપના માટે સદા જાગૃત પ્રહરી રહી છે. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે સમાજમાં સનાતની રાહને પ્રજ્વલિત કરવા સમય-સમય પર આપણને અનેકો સંતો મહંતોનો સહયોગ અને આશીર્વાદ અને દિશાનિર્દેશ મળતા રહ્યા છે. આપણા સમાજના મહાન વડીલોના કાર્યો ઉપર ગર્વ કરી શકીએ એવા વડીલો મળ્યા છે. એવા મહાન વડીલોની શ્રૃંખલા પણ ખૂબ લાંબી છે.

પરમાત્માની અસીમ કૃપાથી ધીરે-ધીરે, જેમ-જેમ લોકોને સનાતન ધર્મના સાચા જ્ઞાનની પ્રતીતિ થઈ તેમ-તેમ, હિન્દુ ધર્મના નામે ચાલતા, અર્ધદગ્ધ, કબ્રસ્તાની, વિધર્મને ત્યજી દેવાની પ્રેરણાના અંકુરો ખીલ્યાં. પૂર્વ જન્મના કોઈ સારા કર્મ હોય, મા-બાપના અમી ભર્યા આશીર્વાદ હોય અને માણસ હૃદયમાં સનાતની બનવાની સાચી અને શુદ્ધ ઇચ્છાશક્તિ હોય એવા કિસ્મતવાળા માણસ જ સાચા સનાતન હિન્દુ ધર્મી બની શકે. બાકી તો આડંબર કરવાવાળા ઘણાય છે.

આ જગતમાં ઘણા લોકો એવા છે જે સનાતન ધર્મનો સાચો રાહ મેળવવા ભટકી રહ્યા છે. હિન્દુ ધર્મ પર આક્રાંતાઓ દ્વારા ફેલાવેલા ધાર્મિક ભ્રમ જાળમાં ફસાઈને એવા આક્રાંત-વિધર્મીઓને જ પોતાના તારણહાર માની બેઠા છે. સ્વર્ગનો મોહ અને કલિયુગના અંતે રાજ કરવાની લાલચથી ગૂંથાયેલ ભ્રમની જાળમાંથી છૂટવું એટલું અઘરું છે કે સાચી વાત જણાય પછી પણ એ મોહ અને લાલચ છૂટતા નથી.

આવા પ્રપંચો અને ભેદભ્રમની જાળમાંથી આપણી જ્ઞાતિને છોડાવનાર સંતો-મહંતો અને મહાન વડીલો દ્વારા આપેલ દિશા પર આપણો સમાજ છેલ્લા લગભગ ૨૨૫ વર્ષથી ચાલવાની શરૂઆત કરી. કોણ જાણતું હતું કે એક માણસ દ્વારા શરૂ કરેલ આગેકૂચ આજે લાખો માણસોનો કારવાં બની ગયો છે.

સનાતન ધર્મ સ્વીકારવાના કારણે, વિધર્મીઓ દ્વારા આપણાં વડીલો પર ગુજારેલ શારીરિક અને માનસિક અસહ્ય અત્યાચારનો સામનો કરતા-કરતા આવ્યા છીએ. સમય-સમય પર સનાતન ચળવળની લહેરમાં હજારો-લાખો લોકો સનાતની બનતા ગયા. આજે આપણે લગભગ ૯૫% છીએ અને વિધર્મીઓ માત્ર ૫% જેટલા છે. આવી પરિસ્થિતિમાં વિધર્મીઓ પાસે ભૂતકાળની જેમ આજે અત્યાચાર ગુજારવાની શક્તિ રહી નથી. માટે આજે એ લોકો ગેરસમજણ અને ભ્રમના હથિયારનો ઉપયોગ કરી સનાતનીઓના ભાગલા પાડવાનો હથિયાર વાપરી રહ્યા છે.

હાલ થોડા દિવસો પહેલાં આપણે જોયું કે વિધર્મના મુખ્ય ગાદીપતિ કાકા અને અમુક કહેવાતા સાધુઓ આપણાં ધાર્મિક સ્થળોની મુલાકાતે આવ્યા. ત્યાં એ લોકોએ ફોટાઓ અને વિડીયો બહાર પાડ્યા અને લોકોમાં એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જાણે તેઓએ સનાતન ધર્મ સ્વીકારી લીધો છે. પોતાના સનાતની પૂર્વજો દ્વારા કરેલ સત્કર્મ ઉપર પાણી ફેરતા એક કથાકથિત સનાતની આગેવાને આવા વિધર્મીઓની આગતાસ્વાગતા કરેલ અને મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં પણ લઈ ગયા. આવા કૃત્યોથી અમુક લોકો ભ્રમિત થયા છે. એક અન્ય સનાતની આગેવાને તો સમાજના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કર્યા વિના, એક જાહેર સભામાં બન્ને સમાજોએ હવે એક થઈ જવું જોઈએ એવી જાહેરાત કરીને પોતાના વિચારોની નબળાઈ પ્રદર્શિત કરી દીધી. માટે સ્વાભાવિક છે કે સનાતની લાગણીઓને ઠેસ લાગે અને વ્યથિત હૃદયે ઉગ્ર નિવેદનો જનતા તરફથી સમાજ પાસે આવે.

સનાતન ધર્મ માટે પોતાના પૂર્વજોએ આપેલ બલિદાનો ઉપર પાણી ફેરવાની થતી કોશિષ અને સનાતની ચળવળને નુકસાન કરતી ગતિવિધિઓથી ચિંતિત અને વ્યથિત લોકોના આક્રોશ ભર્યા નિવેદનો સમાજ સમજે છે અને કદર પણ કરે છે. છેલ્લા લગભગ ૧૫ વર્ષથી ઉપડેલ સનાતની ચળવળના ધાર્યા કરતાં પણ ખૂબ સારાં પરિણામોના આપણે સૌ પ્રત્યક્ષ સાક્ષી છીએ જ. ૧૫ વર્ષ અગાઉ વિધર્મીઓની વધુ પડતી દખલગીરીના કારણે આપણી સમાજની સંસ્થાઓમાં આપણે સનાતન ધર્મની જય નહોતા બોલાવી શકતા. આપણી એક પણ સંસ્થા ચોખ્ખી નહોતી બચી. બધીજ સંસ્થાઓમાં

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1427/page/n4/mode/1up

realpatidar.com

વિધર્મીઓને છાવરવામાં આવતા. સનાતનીઓની ઉપેક્ષા અને એમનું તુષ્ટિકરણ થતું હતું.

પણ આજે સનાતની ચળવળની સફળતા એ છે કે આજે આપણી સંસ્થાઓ મોટે ભાગે ચોખ્ખી થઈ ગઈ છે અને એ પ્રક્રિયા ચાલુ જ છે. છેલ્લા ૧૫ વર્ષમાં હજારો વિધર્મીઓ પ્રેમથી સનાતની બન્યા અને આપણે એમને હૃદયથી સ્વીકાર્યા. કચ્છના ગામેગામથી સનાતન સમાજમાં ભળવાનો પ્રવાહ ચાલ્યો. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક, આંધ્ર, બંગાલ હોય કે દક્ષિણ ભારત હોય. એવી રીતે સ્થાનિક સમાજો હોય, મહિલા સંઘ હોય, યુવાસંઘ હોય કે ગોત્રિય પરિવારો હોય. બૌદ્ધિક દૃષ્ટિએ પંચામૃત ગણાતા આપણાં ડોક્ટર, સારસ્વત, સી.એ., વકીલો, એંજીનિયર વગેરે સંગઠનોએ પણ જહેમત ઉઠાવીને ચોખ્ખા થઈ સમાજને ખૂબ જ સાથ સહકાર આપ્યો.

આ બદલાવોનો સમાજના લોકોએ પણ મક્કમ તેમજ ઉમળકાભેર આવકાર આપ્યો. આપણી શુદ્ધ સનાતની સંસ્થાઓમાં દાનનો પ્રવાહ ઉદાર હાથે વહેવા લાગ્યો. કોરોનાના કપરાંકાળમાં સાહસ કરીને લેવામાં આવેલ ભુજમાં આપણી સમાજની જગ્યા માટે દાતાઓ અને જ્ઞાતિજનોનો ઉત્સાહ આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.

વિધર્મીઓ ભલે કેટલાક ધાર્મિક અને હિન્દુસંગઠનોનો સહારો લઈને પોતાને હિન્દુ દેખાડવાનો પ્રયત્ન કરી, પોતાના લોકોને સનાતન તરફ જતાં અટકાવવાના પ્રયત્નો કર્યા હોય, પણ કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા પછી એમાં એમણે કોઈ વિશેષ સફળતા નથી મળી. હાલમાં તેઓએ ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિઓ પોતાના ધર્મ સ્થાનકમાં બેસાડી હોવા છતાં જેમ-જેમ લોકોને સાચી વાત સમજાય છે, તેમ તેમ સનાતન સમાજમાં ભળતા જાય છે.

હાલ, જૂજ દિવસો પહેલાં જ અંગિયા ગામમાંથી વિધર્મના મુખી પરિવાર જેમાં ડોકટરો જેવા ભણેલ ગણેલ સભ્યો છે, એવો પરિવાર સનાતન સમાજમાં જોડાયો. આ તો એક દાખલો માત્ર છે. માત્ર અંગિયામાં છેલ્લા ૪-૫ મહિનામાં ૫-૬ પરિવારો સનાતનમાં આવ્યા. સનાતની ચળવળની સફળતા એટલી સારી છે કે એક અંદાજ પ્રમાણે કચ્છમાં હવે માત્ર એક થી બે હજાર લોકો જ વિધર્મમાં બચ્યા છે. એ લોકોનો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો એ-ને-એજ લોકો છાપેલા કાટલા સમાન બધા કાર્યક્રમોમાં દેખાય અથવા તો કચ્છની બહારથી આવેલ એટલે કે કંપા વગેરેના લોકો જ દેખાય.

આપણી માતૃ સમાજ આ ચળવળને કોઈ પણ રીતે નુકસાન નહીં કરે. તેમજ આ ચળવળના સહયોગમાં અડીખમઉભો રહેશે. તેમ છતાં વિધર્મના સાધુઓનું આપણાં ધાર્મિક સંસ્થાઓની મુલાકાતે આવવું અને ત્યાં કોઈ નબળા વિચારધારા વાળા વ્યક્તિ દ્વારા આવગત કરવામાં આવ્યું એનાથી સનાતનીઓ આહત થયા છે. તેવીજ રીતે જાહેર કાર્યક્રમમાં વિધર્મીઓ સાથે ભળી જવાની વાતો કરવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણી માતૃ સમાજ આ બંને ઘટનાને વખોડી કાઢે છે.

વિધર્મીઓથી થતી ગતિવિધિઓ ઉપર આપણાં સમાજ દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. બધીજ બાબતો પર સમાજ સંવેદનશીલ છે. ઇતિહાસના દાખલા બધીજ પ્રકારના હોય. કોઈ કામ કરવું હોય તો એવા દાખલા મળી જાય અને એજ કામ ના કરવું હોય તો બીજા પ્રકારના દાખલાઓ મળે. પણ ઇતિહાસમાંથી પૃથ્વીરાજ ચૌહાણનો દાખલો આપણે ભૂલશું નહીં. વિધર્મીઓની દગો દેવાની રણનીતિ ખૂબ પ્રખ્યાત છે જ. એવા સંજોગોમાં જ્યાં સુધી એ લોકો વિધર્મનો સંપૂર્ણ ત્યાગ ના કરે ત્યાં સુધી સનાતન સમાજમાં ભેળવવાની કોઈ વાત આપણી માતૃ સમાજ ધ્યાને નહીં લે, એ ખાસ નોંધ લેશો. આપણાં વિશેષ સભાના ઠરાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

જ્યાં સુધી આપણી માતૃ સમાજ તરફથી કોઈ પણ સૂચન લેખિત રીતે ના આવે, ત્યાં સુધી આપણે સર્વે ધ્યાન રાખવાનું છે કે તા. ૨૬-૦૮-૨૦૧૮ની વિશેષ સભાના ઠરાવોને વળગી રહેવાનું છે. તેમજ વિશેષ સભાના ઠરાવોના વિરુદ્ધમાં કોઈએ વ્યક્તિગત નિવેદનો જાહેરમાં ના કરવા શ્રી સમાજ આપને ભલામણ કરે છે. તેમજ પરિસ્થિતિ પ્રમાણે કોઈને વિચાર આવે કે આપણાં નીતિ નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે તો એ બાબતે આપણી માતૃ સમાજ સામે વાત મૂકે અને માતૃ સમાજ દ્વારા લેવામાં આવેલ નિર્ણય સાથે વળગી રહે. આપણે સર્વે સમાજના જવાબદાર વ્યક્તિઓ છીએ અને સમાજ પ્રત્યે આપણી જવાબદારી સમજી વ્યવહાર કરશું તો જ આપણી અને સમાજની ગરિમા જળવાશે.

અબજીભાઈ કાનાણી-પ્રમુખ
પુરુષોત્તમભાઈ ભગત-મહામંત્રી
અ.ભા.ક.ક.પા. સમાજ

હિતેશભાઈ રામજિયાણી-પ્રમુખ
ભરતભાઈ છાભૈયા-મહામંત્રી
અ.ભા.ક.ક.પા. યુવા સંઘ

જશોદાબેન નાકરાણી-પ્રમુખ
રમીલાબેન રવાણી-મહામંત્રી
અ.ભા.ક.ક.પા. મહિલા સંઘ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1427/page/n5/mode/1up

realpatidar.com

Ravapar Sarva
#History - later
few people went
back to Satpanth

સો ટકા સનાતની

રામપર-સરવા ગા

નખત્રાણા તાલુકાનું રામપર સરવા ગામ ગત તા-૩-૫-૨૦૨૨ને અખાત્રીજના પવિત્ર દિવસે સંપૂર્ણ પણે સનાતની બની ગયું છે. બદલાતા સમયને સાથે આજે પરિવર્તન અનિવાર્ય બની ગયું છે. પછી ભલેને ધંધો હોય કે ધર્મ હોય.. પણ જે રસ્તે ૯૦% આમ જનતા ચાલતી હોય એની સાથેઆમ જનતા સાથે રહેવું, ચાલવું એ સમય સતત સૂચવતો રહ્યો છે. છેક્ષા ઘણા સમયથી અલગ વિચારધારાને વરાયેલા ભાઈઓ સનાતન પ્રવાહમાં જોડાઈ જવું એવું મનથી વિચારી રહ્યા હતા. જે કાર્યમા ઉમિયા અને ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણની કૃપાથી ગત અખાત્રીજના રુડી અને રૂપાળી રીતે સંપન્ન થતાં ગ્રામજનોમા આનંદનો માહોલ છવાયો હતો. અને નવા જોડાયેલા ભાઈઓ વતીથી ચલાવવામા આવતી ઉમિયા સમાજ નામક સંસ્થાને શ્રી લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજમા વિલીનીકરણ કરી હવે પછી આજથી રામપર ગામમા એકજ સમાજ જે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ જ રહેશે એવી જાહેરાત કરાઈ હતી.

અને સર્વ શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજના હોદેદારશ્રીઓ, ઉપસ્થિત સભ્યો, ગામવાસીઓ તેમજ નવા જોડાયેલ પરિવારના આગેવાનો સૌ એક સાથે બેસી મો મીઠાં કરતી વેળાએ એક બીજાના ચહેરા પર એકતાનું સ્મિત છલકાયું હતું. અને આજનો દિવસ રામપર-સરવા ગામવાસી માટે ઐતિહાસિક દિવસ તરીકે હંમેશાં યાદ કરવામાં આવશે.

એકતા રૂપી કાર્યને સફળ બનાવવામાં કેન્દ્રીય મુખ્ય ટ્રસ્ટીગણ શ્રી ગોપાલભાઈ ભાવાણી, શ્રી સમાજના ઉપપ્રમુખ શ્રી ભાણજીભાઈ કડોદરા, કેન્દ્રીય સમાજના ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી મનુભાઈ કાનજી નાકરાણી, ફલટણ નેત્રા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વિનયકાન્તભાઈ રવાણી, લોકાપુર, ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ પચાણભાઈ જાદવાણી, મહામંત્રી શ્રી કરમશીભાઈ કાનજી માકાણી અને ઓડિટર શ્રી રામજીભાઈ પેથાણી અમદાવાદ, સભ્યશ્રી હરિભાઈ જાદવાણી, ૨૪ ગામ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી, મહામંત્રીશ્રી વગેરે મુખ્ય મુરબ્બીઓ ઉપસ્થિત રહી અથાગ મહેનત થકી આ એકતારૂપી કાર્ય સફળ બનાવતા ગામનું સંગઠન મજબૂત બન્યું હતું.

ગઢશીશા ખાતે લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ઊજવાયો

– મણિલાલ ધોળુ દ્વારા

ગઢશીશા ઉમિયાનગર પાટીદાર સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો ૧૩મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી તા. ૬ અને ૭/૫ના ધામધૂમથી કરવામાં આવી હતી. તા. ૦૬/૦૫/૨૦૨૨ના બપોરના ૪.૦૦ કલાકે જયશ્રી દીદી મંગલધામ આશ્રમ-નાગલપર અને ચંદુમા અંબેધામ દ્વારા સંગીતમય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૯.૦૦ કલાકે શોભાયાત્રા અને ધજાના ચડાવા લેવામાં આવ્યા હતા.

તા. ૦૭/૦૫/૨૦૨૨ના સવારના ૭.૩૦ કલાકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ભવ્ય શોભાયાત્રા વાજતેગાજતે કાઢવામાં આવી હતી.

બપોરના ૧૨.૦૦ કલાકે હોમહવન વિધિ અને ધ્વજારોહણ તથા ગઢશીશા ગામની બંને પાટીદાર સમાજનો

realpatidar.com